



મે. વાપીના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટમાં,

મુ. વાપી જી. વલસાડ

ફોજદારી પરચુરણ અરજી નં. 424/2026

આંક - ૧ લગત હુકમ

અરજદાર : ICICI BANK LIMITED, Through its Authorized officer : Prashant Shishodia, a company incorporated under the Companies Act, 1956 and a banking company with the meaning of Banking Regulation Act, 1949,

સરનામું : Registered office :at ICICI BANK Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara-390007,
Corporate office at ICICI Bank Towers, Bandra Kurla Complex, Bandra, Mumbai-400051
Branch office: At ICICI Bank Ltd., 1ST Floor, Geet Prabha Building, Majura Gate, Surat-395002,

Versus

સામાવાળા નં. 1. MANOHAR RAMRAO SHINDE

Add: (1) Flat No-B-205, Shree Sahjanad Co.Op. Society, Hari Park, Vapi silvassa Road, Village : Dungar-Vapi – 396191.

Add: (2) Flat No- 302, 3rd Floor, Shashwat Co-Operative Housing Society Limited, Vapi Municipality, Hariya Park, Dungara R.S. No.219/2, 219/2P & 219/3, Plot No.121, Taluka Pardi-Vapi 396295.

Also (3) Bhumi Yarn Pvt Ltd, S.No.278/283, Nr. Cenal Demini Roa, Dadara, Silvasa -396230.

સામાવાળા નં. 2. AKASHATA MANOHAR SHINDE

Add: (1) Flat No-B-205, Shree Sahjanad Co.Op. Society, Hari Park, Vapi silvassa Road, Village : Dungar-Vapi – 396191.

Add: (2) Flat No- 302, 3rd Floor, Shashwat Co-Operative Housing Society Limited, Vapi Municipality, Hariya Park, Dungara R.S. No.219/2, 219/2P & 219/3, Plot No.121, Taluka Pardi-Vapi 396295.

બાબત : સીક્યુરિટી ઇન્ટરેસ્ટ ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ
ઓફ સીક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ - ૧૪ મુજબ.

એપિયરન્સ :- અરજદાર તરફે વિદ્વાન વકીલશ્રી: શૈલેષકુમાર એ. ઘેવરીયા (G-3212/2015)

નિકુંજ જે. સવાણી (G-206/2018)

સામાવાળા તર્ફે - કોઈ નથી

:: ઠરાવ ::

૧. હાલની અરજીની ટૂંકમાં હકીકત એવી છે કે, અરજદાર તરફે સીક્યુરિટી ઇન્ટરેસ્ટ ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૦ની કલમ-૧૪માં જણાવ્યા મુજબની ફાયનાન્સીયલ ઇન્સ્ટીટ્યુશન છે અને ફાયનાન્સને લગતી કામગીરી કરે છે. જે અંગેનું નોટીફિકેશન અરજી સાથે રજુ કરેલ છે. આ કામના સામાવાળાએ અરજદાર પાસેથી તા.૨૦/૦૭/૨૦૧૧ ના હાઉસીંગ લોન એકાઉન્ટ નં. LBVPI00001878256 થી રૂ. ૦૭,૦૭,૫૨૦/-, (અંકે રૂપિયા સાત લાખ સાત હજાર પાંચસો વીસ પુરા) Credit facility/loan against property/Home Loan/Top up/ Loan લોન લીધેલ અને તે સંબંધિત જરૂરી દસ્તાવેજો કરી આપેલ અને સામાવાળાની માલિકીની પ્રોપર્ટીની વિગતો નીચે મુજબ છે :

Description Of the Mortgaged Property / Secured Asset:

" ALL THE PIECE AND PARCEL OF THE IMMOVABLE PROPERTY OF FLAT NO. 302 ADMESURING ABOUT 640.00 SQ. FET'S EQUIVALENT TO 59.47 SQ. MTRS, SUPER BUILT-UP AREA, LYRING AND LOCATED ON THIRD FLOOR BUILDING KNOWN AS 'SHASWAT CO.OPERATIVE HOUSING SOCIETY LIMITED' WHICH UINDIVIDED SHARE IN THE LAND IS 10.00 SQUARE METTERS, WITH ALL RIGHT, TITLE, INTEREST AND BENEFITS THERETO, WHICH IS REGISTERED BEARING HOUSE No.13/1005 IN THE OFFICE OF VAPI NAGAR PALIKA, AT.DUNGARA THE SAID BUILDING COSTRUCTED IN N.A. LAND BEARING PLOT No.121, Totally Admeasuring 6963.00 Sq.Ft. Bearing Revenue SURVEY NO. 219/2,219/2P &219/3, SITUATED LYING\ AND BEING AT DUNGRA WITHIN THE MUNICIPALI LIMITS OF VAPI , TALUKA:VAPI, DISTRICT: VALSAD, GUJARAT."

વાળી મીલકત અરજદારને ગીરો લખી આપેલ. જેથી સામાવાળાએ ઉપરોક્ત કાયદાની કલમ – ૨ (૧) (એફ) માં જણાવ્યા મુજબના દેણદાર છે તથા અરજીમાં જણાવ્યા મીલકતો ઉપરોક્ત કાયદાની કલમ-૨(૧)(ઝેડસી)માં જણાવ્યા મુજબની સીક્યોર્ડ એસેટસ છે. સામાવાળાએ લોન લીધા બાદ લોનની રકમની ભરપાઈ કરેલ ન હોય, સામાવાળાનું અરજદારની લોનનું ખાતું તા.૧૨/૦૫/૨૦૨૫ના રોજ **Non-Performing Asset (N.P.A.)** થયેલ છે. અને અરજદારે સામાવાળા પાસેથી મૂળ રકમ તથા વ્યાજ-ચાર્જીસ સહિત તા.૩/૭/ ૨૦૨૫ના રોજ લોન એકાઉન્ટ નં.LBVPI00001878256થી રૂ.૨,૭૩,૬૭૬.૧૧/-, (અંકે રૂપિયા બેલાખ તોતેર હજાર છસો છોતેર અને ફક્ત અગીયાર પૈસાપુરા) બાકી લેણા નીકળે છે જેથી અરજદારે તા.૩/૦૭/ ૨૦૨૫ના રોજ ની કલમ-૧૩(૨) મુજબની સામાવાળાએ ૬૦ દિવસમાં રકમ ભરપાઈ કરવાની ડિમાન્ડ નોટીશ આર.પી.એડી./સ્પીડ પોસ્ટ મારફતે તા.૨૮/૭/ ૨૦૨૫ના મોકલી આપેલ. જે નોટીસ સામાવાળાને મોકલ્યાનું ટ્રેકીંગ રીપોર્ટ અરજી સાથે રજુ કરેલ છે. ત્યારબાદ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના રૂલ ૩ મુજબ તા.૦૩/૭/૨૦૨૫ ની ડિમાન્ડ નોટીસ લોકમિત્ર (ગુજરાતી) તથા ફ્રી પ્રેસ ગુજરાત (અંગ્રેજીમાં) દૈનિક અખબારમાં પણ નોટીશ પ્રસિધ્ધ કરાવેલ. જે નોટીસની સામાવાળાને બજવણી થયેલ. ત્યારબાદ પણ સામાવાળાએ કોઈ રીપ્રેઝેન્ટેશન કરેલ નહીં. સામાવાળાએ ૬૦ દિવસમાં રકમ ભરપાઈ કરેલ નથી. તેથી ઉપરોક્ત વિગતેની કલમ ૧ ૩(૨) મુજબની કાર્યવાહી કરવામાં આવેલ. ત્યારબાદ તા.૦૫/૧૨/ ૨૦૨૫ના રોજ અરજદાર તરફે રૂલ્સ ૮(૧) મુજબની પ્રોપર્ટીના સાંકેતિક કબજા નોટીસની કલમ- ૧૩(જ) મુજબની કાર્યવાહી કરેલ અને ત્યારબાદ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના રૂલ ૩ મુજબ તા.૧૧/ ૧૨/ ૨૦૨૬ ના રોજ લોકમિત્ર (ગુજરાતી) તથા ફ્રી પ્રેસ ગુજરાત(અંગ્રેજીમાં) દૈનિક અખબારમાં પણ નોટીશ પ્રસિધ્ધ કરાવેલ. ત્યારબાદ પણ સામાવાળાએ કોઈ રીપ્રેઝેન્ટેશન કરેલ નહીં. આમ, નોટીસની સામાવાળાને બજવણી થયેલ. તે રીતે અરજદારે સામાવાળા પાસે બાકી લેણાની રકમની માગણી કરેલ છે પરંતુ સામાવાળાએ ૬૦ દિવસમાં ભરપાઈ કરેલ નથી. જેથી અરજદારે લોન એકાઉન્ટ નં.LBVPI00001878256થી રૂ.૨,૭૩,૬૭૬.૧૧/-, (અંકે રૂપિયા બેલાખ તોતેર હજાર છસો છોતેર અને ફક્ત અગીયાર પૈસાપુરા) લેણી રકમ માટે હાલની અરજી તા.૧૦-૬-૨૦૨૬ના રોજ દાખલ કરી વલસાડ જીલ્લાના વાપી તાલુકામાં સિક્યોરડ એસેટ તરીકે દર્શાવેલ મીલકત :

Description Of the Mortgaged Property / Secured Asset:

" ALL THE PIECE AND PARCEL OF THE IMMOVABLE PROPERTY OF FLAT NO. 302 ADMESURING ABOUT 640.00 SQ. FET'S EQUIVALENT TO 59.47 SQ. MTRS, SUPER BUILT-UP AREA, LYRING AND LOCATED ON THIRD FLOOR BUILDING KNOWN AS SHASWAT CO.OPERATIVE HOUSING SOCIETY LIMITED WHICH UINDIVIDED SHARE IN THE LAND IS 10.00 SQUARE METTERS, WITH ALL RIGHT, TITLE,

INTEREST AND BENEFITS THERETO, WHICH IS REGISTERED BEARING **HOUSE No.13/1005** IN THE OFFICE OF VAPI NAGAR PALIKA, AT.DUNGARA THE SAID BUILDING COSTRUCTED IN N.A. LAND BEARING PLOT No.121, Totally Admeasuring 6963.00 Sq.Ft. Bearing Revenue SURVEY NO. 219/2,219/2P &219/3, SITUATED LYING\ AND BEING AT **DUNGRA** WITHIN THE MUNICIPAL LIMITS OF **VAPI** , TALUKA:**VAPI**, DISTRICT: VALSAD, GUJARAT.”

વાળી સ્થાવર મીલકતનો કબજો મેળવવા રીસીવરની નિમણુક કરી અને તેમણે જરૂર પડયે પોલીસની મદદ લેવા.મિલકત ઉપર જો કોઈ સાંકળ તાળા મારેલ હોય તો તે તોડી/ખોલી આપી તેનો કબજો અપાવવા હુકમ થવા દાદ માંગેલ છે.

૨. સદર અરજી રજુ થતા જોઈ તપાસી રજીસ્ટરે લેવામાં આવેલ છે અને અરજદારપક્ષે વિ.વકીલશ્રીને વિગતવાર સાંભળ્યા, તેમના તરફે રજુ સર્વોચ્ચ અદાલતના ચુકાદા (૧) મે. આર. ડી. જેન એન્ડ કંપની વી. કેપીટલ ફર્સ્ટ લીમી.(સીવીલ અપીલ નં.૧૭૫/ ૨૦૨૨) તથા નામ.ગુજરાત હાઈકોર્ટના ચુકાદા કોટક મહીન્દા બેંક લીમી.વી.સ્ટેટ ઓફ ગુજરાત (સ્પેશ્યલ સીવીલ એપ્લીકેશન નં.૧૨૨૪૪/૨૦૨૨) ના ચુકાદા માનપુર્વક ધ્યાને લીધા,સદર ચુકાદામાં ઠરાવેલ સિધ્ધાંત મુજબ એડી. ચીફ. મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ને સદર કામ ચલાવવાની સત્તા હોવાનું અને એડી. ચીફ. જયુડી. મેજી. સક્ષમ જયુડીશીયલ ઓફિસર હોવાનું ઠરાવવામાં આવેલ છે.ઉપરોક્ત ચુકાદાના વિચારણીય બાબતે પ્રશ્ન જોતા, એડી. ચીફ. જયુડી.મેજી.ને સત્તા હોવાનો વિવાદ છે.જેમાં એડી.ચીફ.જયુડી.મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ અધિકૃત સત્તાધિશ હોવાનું ઠરાવવામાં આવેલ છે.હાલની અરજી એડી.ચીફ.જયુડી.મેજી.સમક્ષ રજુ કરવામાં આવેલ છે જે એડી. ચીફ. જયુડી. મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કક્ષાનો હોદો ધરાવતા અધિકારી હોવાનું નમ્મતાપુર્વક સી. આર. પી. સી.કલમ-૧૧,૧૨,૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૩૫ ની જોગવાઈ ધ્યાને લેતાં , સક્ષમ અધિકારી હોવાનું માનું છું અને રજુ હકીકતે અત્રેની અદાલતને સદર અરજી સાં ભળવા હકુમત હોવાનું માનવામાં આવે છે.

૩. વધુમાં,નામ.મદ્રાસ હાઈકોર્ટના Indian Overseas Bank K. Abhishekpuram Branch V/s Shree Arvind Steel Ltd.ના ચુકાદામાં પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંત મુજબ કાયદાની કલમ-૧૪ મુજબ અદાલતે સામાવાળાને નોટીશ બજાવવાની કોઈ જરૂરીયાત નથી અને સીક્યોર્ડ ક્રેડીટર ધ્વારા કલમ-૧૩(૨) મુજબ નોટીશ ઈશ્યું કરેલ હોય,તેટલું પુરતુ છે.જેથી અરજદારે સામાવાળા ને નોટીશ ઈશ્યું કરેલ હોય,તેથી કોર્ટ રાહે પણ નોટીશ ઈશ્યું કરવાની જરૂર ન હોય તે રજુઆત ધ્યાને લેવામાં આવે છે.

૪. અરજીની વિગતો અને રજુ હકીકતે આ કામે સેક્શન-૧૪ ની જોગવાઈ ધ્યાને લેવામાં આવે તો, તેમાં અદાલતે સીક્યોર્ડ ક્રેડીટરને સીક્યોર્ડ એસેટસનું પઝેશન લેવામાં મદદ કરવા બાબતની કલમ છે અને આ કલમના આધારે અદાલત આવી સીક્યોર્ડ એસેટસનો કબજો સીક્યોર્ડ ક્રેડીટરને અપાવી શકે. હાલના કીસ્સામાં પણ અરજદારે સીક્યોર્ડ એસેટસનો કબજો માંગેલ છે અને ઉપરોક્ત ચર્ચા કર્યા મુજબ અરજીમાં જણાવેલ મીલકત અરજદાર સમક્ષ ગીરો મુકવામાં આવેલ હોવાનું પ્રથમ માનવાને કારણ જણાય છે. તે સંજોગોમાં અદાલતે તેનો કબજો અપાવવા હુકમ કરવાનો હોય છે. જેથી કલમ-૧૪ હેઠળ આવી ગીરો મુકેલ મીલકતનો કબજો અપાવવા હુકમ થઈ શકે તેવી સ્પષ્ટ જોગવાઈ છે અને આ અરજીના સંદર્ભમાં અરજદારના અધિકૃત અધિકારીનું સોંગંદનામું કરવામાં આવેલ છે તે જોતા ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટ્યુશનના અધિકૃત વ્યક્તિ એ તેમના વતી હાલની અરજી કરેલ છે અને તેના સમર્થમાં સોંગંદનામું કરેલ છે. તેમાં પણ અરજીની હકીકતોને સોંગંદ પર જાહેર કરેલ છે.

૫. વધુમાં, As Per the Section -14 of Securitization Act 2002 was amended on 16.8.2016 by virtue of amendment the the District Magistrate or the Chief Metropolitan Magistrate or the Chief Judicial Magistrate has to decide the Application preferred Under Section 14 of the Act within 30 Days. The amended provision runs thus: “... Provided Further that on receipt of the Affidavit from the authorised officer. The District Magistrate or the Chief Metropolitan Magistrate or the Chief Judicial Magistrate, as the case may be, shall after satisfying the contents of the affidavit pass suitable order for the purpose of taking possession of the secured assets [within a period of thirty days from the date of application] મુજબનો સદરહુ કાયદાના નિયમોમાં સુધારો થયેલ છે.

૬. અરજીનું રેકર્ડ જોતાં, અરજદારે હાલની અરજીના સમર્થનમાં આંક-૩ થી દસ્તાવેજી નકલો રજુ કરેલ છે. જે વિગતો જોતા, તેમાં અરજદારે સામાવાળાઓને તેમની બાકી લેણાની રકમ નોટીશની તારીખથી ૬૦ દીવસમાં ભરપાઈ કરવા જણાવેલ છે. આમ, અરજદારે કાયદાની જોગવાઈ મુજબ નોટીશ આપી બાકી લેણી રકમ ભરપાઈ કરવા સામાવાળાઓને નિયત સમય આપેલ છે.

૭. આમ, અરજદારે અરજીના સમર્થનમાં નિયમ મુજબ સોંગંદનામું કરી તથા સામાવાળાઓને કાયદાની જોગવાઈ મુજબ નોટીશ આપી અને કાયદાએ નિયત કરેલ સમયમાં બાકી લેણું ભરપાઈ કરવા સામાવાળાને તક આપેલ હોય અરજદારે આ અરજી માટે જરૂરી જોગવાઈઓનું પાલન કરેલ છે. જેથી અરજદારને અરજીમાં જણાવેલ

મીલકતનો કબજો લેવા અત્રેની અદાલતની મદદ મેળવવા હકકદાર હોય,નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે.

આખરી હુકમ

- (૧) અરજદારની અરજી મંજૂર કરવામાં આવે છે.
- (૨) સીક્યુરાટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૦ ની કલમ-૧૪(૧-એ) અન્વયે રીસીવર /કોર્ટ કમિશનર તરીકે કાર્યવાહી કરવા માટે સદર કમિશન પેટેના નાણા પ્રોપર્ટી દીઠ અત્રેની અદાલતમાં જમા કરાવ્યેથી કમિશનર માટે હુકમ કરવામાં આવશે.
- (૩) અરજદાર ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટ્યુશનના અધિકૃત વ્યક્તિએ કોર્ટ કમિશનરશ્રી નો સાથે સંપર્ક કરી સીક્યોર્ડ એસેટનો કબજો લેવાની કાર્યવાહી દરમિયાન હાજર રહેવું. કોર્ટ કમિશનરશ્રીએ નીચે જણાવેલ મિલકતનો કબજો અરજદાર ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટ્યુશનને સ્થળ ઉપર કબજો સોંપી આપવો અને વિગતવારનો રીપોર્ટ કરવો.

– મિલકતનું વર્ણન –

Description Of the Mortgaged Property / Secured Asset:

" ALL THE PIECE AND PARCEL OF THE IMMOVABLE PROPERTY OF **FLAT NO. 302** ADMESURING ABOUT **640.00 SQ. FET'S** EQUIVALENT TO **59.47 SQ. MTRS**, SUPER BUILT-UP AREA, LYRING AND LOCATED ON **THIRD FLOOR** BUILDING KNOWN AS **'SHASWAT CO.OPERATIVE HOUSING SOCIETY LIMITED** WHICH UINDIVIDED SHARE IN THE LAND IS 10.00 SQUARE METTERS, WITH ALL RIGHT, TITLE, INTEREST AND BENEFITS THERETO, WHICH IS REGISTERED BEARING **HOUSE No.13/1005** IN THE OFFICE OF **VAPI NAGAR PALIKA, AT.DUNGARA** THE SAID BUILDING COSTRUCTED IN N.A. LAND BEARING PLOT No.121, Totally Admeasuring 6963.00 Sq.Ft. Bearing Revenue SURVEY NO. 219/2,219/2P &219/3, SITUATED LYING\ AND BEING AT **DUNGRA** WITHIN THE MUNICIPALI LIMITS OF **VAPI** , TALUKA:**VAPI**, DISTRICT: VALSAD, GUJARAT."

- (૪) જો ઉપરોક્ત મીલકત બંધ હાલતમાં જણાય તો,કોર્ટ કમિશનરશ્રીએ તે મીલકતનું તાળુ તોડી/ખોલી અથવા અન્ય કોઈ પણ રીતે કબજો લઈ શકશે.

મિલકતનો કબજો લીધા બાદ જે તેમાં કોઈ માલસામાન અથવા કોઈ દસ્તાવેજ કે ચીજવસ્તુઓ જણાઈ આવે તો તેની યાદી બે નકલમાં તૈયાર કરી એક નકલ અરજદારને આપવી અને બીજી નકલ રીપોર્ટ સાથે રેકર્ડમાં સામેલ રાખવી. ઉપરોક્ત મીલકત જે પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોય, તે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીશ્રીએ મિલકતનો કબજો લેતા સમયે કોર્ટ કમિશનરશ્રીને પોલીસની મદદ/રક્ષણ આપવું અને અરજદારે ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટ્યુશનને પોલીસ રક્ષણ મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરવી અને તેનો જરૂરી ખર્ચ ભોગવવો. કોર્ટ કમિશનરશ્રી તેમના વ્યાજબી મત મુજબ જરૂરી પગલાં ભરી શકશે અને જરૂરી બળપ્રયોગ કરી શકશે. હકુમત ધરાવતા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીશ્રીને હુકમની યાદી કરવી.

(પ) ઉપરોક્ત મિલકતનો કબજો લેવા માટે થનાર તમામ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે અને મીલકતનો કબજો લેવા માટે કોર્ટ કમિશનરશ્રીને કાયદેસરની મદદની જરૂર હોય, તે પુરી પાડવાની રહેશે. અરજદારે આ મીલકતનો કબજો લેવાના કોર્ટ કમિશનરશ્રીના મહેનતાણાના પેટે હાલના તબક્કે **રૂ.૨૫,૦૦૦/- (અંકે રૂપિયા પચીસ હજાર પુરા)** જમા કરાવવાના રહેશે અને આ રકમ જમા થયેથી મિલકતનો કબજો અપાવવા ની કાર્યવાહી સત્વરે અને રજાના દિવસે વિકલ્પે કોર્ટના સમય સિવાયના સમયે કરવી અને **દિન-૩૦** માં પુર્ણ કરી વિગતવારનો રીપોર્ટ કરવો.

હુકમ આજરોજ તા.૨૨મી, માહે :જુન, સને ૨૦૨૬ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.

તા.૨૨/૦૬/૨૦૨૬

સ્થળ : વાપી

(આઈ. એ. શેખ)

પ્રિન્સી.સીની.સીવીલ જજ અને

એડી.ચીફ.જ્યુડી.મેજી,વાપી

કોડ-જી.જે.૦૦૫૬૭